

## સંશોધન વૈજ્ઞાનિક (મગફળી)

**મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ**

### કૃષિ મહોત્સવ માટેના સવાલ-જવાબ

<b>પ્રશ્ન:૧</b>	આગોતરુ(ઓરવણ) વાવેતર એટલે શું ? આગોતરુ વાવેતર ક્યારે કરવું અને કઈ જાતો પસંદ કરવી જોઈએ ?
<b>જવાબ</b>	ચોમાસાનો વાવણી લાયક વરસાદ થાય તે પહેલા જમીનમાં પિયત આપી ઓરવણ કરી વરાપ થયે વાવેતર કરવમાં આવે છે તેને આગોતરુ વાવેતર કહેવામાં આવે છે. સંશોધનના પરિણામો ઉપરથી ભલામણ કરવામાં આવેલ છે કે મે મહિનાનાં છેલ્લા અઠવાડિયામાં અથવા તો જૂન મહિનાનાં પ્રથમ અઠવાડિયામાં વાવેતર થઈ જાય તે રીતે ઓરવણું કરી વાવેતર કરવાથી વધારે ઉત્પાદન તથા આર્થિક ફાયદો થાય છે. વધારે વહેલું વાવેતર કરવાથી સાપેબર માસમાં જો વધુ વરસાદ થાયતો મગફળી તુટી જવાથી આર્થિક રીતે નુકશાની થાય છે. આગોતરા વાવેતર માટે વેલડી (આડી) જાતો પસંદ કરવી, જેવીકે જી.એ.યુ.જી.-૧૦, જી.જી.-૧૧, જી.જી.-૧૨, જી.જી.-૧૩, એમ-૧૩, જીજેજી-એચ્યુપીએચ્ય-૧ અને જીજેજી-૧૭ જેવી મોડી પાકતી વેલડી મગફળીની જાતોનું વાવેતર કરવું જોઈએ.
<b>પ્રશ્ન:૨</b>	મગફળીની સુધારેલી કઈ કઈ જાતોની વાવેતર માટે ભલામણ કરેલ છે. વાવણી અંતર અને બિયારણનો દર કેટલો રાખવો ?
<b>જવાબ</b>	ચોમાસુ મગફળીના વાવેતર માટે ત્રણ પ્રકારની મગફળીની જાતો છે જેવીકે વેલડી (આડી) મગફળીની જાતો જેવીકે , જીએયુજી-૧૦, જીજી-૧૧, જીજી-૧૨ , જીજી-૧૩, જીજેજી-એચ્યુપીએસ-૧, જીજેજી-૧૭, અનેજ્યારે ઉભ્યી મગફળીની જાતો જેવીકે જીજી-૨ , જીજી-૫, જીજી-૭, જીજેજી-૮ અને અર્ધ વેલડી મગફળીની જાત જેવીકે જીજી-૨૦ અને જીજેજી-૨૨ જાતનું વાવેતેર કરવાની ભલામણ છે. વાવેતર અંતર માટે વેલડી જાતો માટે બે ચાસ વચ્ચે ૭૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી. અંતર રાખી, ૧૦૦ થી ૧૧૦ કિલો દાણા / હે. અને ઉભ્યી જાતો માટે બે ચાસ વચ્ચે ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૭.૫ થી ૧૦ સે.મી. નું અંતર રાખી, ૧૦૦ કિલો / દાણા અને અર્ધવેલડી જાતો માટે બે ચાસ વચ્ચે ૬૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦ સે.મી.નું અંતર રાખી ૧૨૦ કિલો દાણા નું / હે. વાવેતર કરવું.
<b>પ્રશ્ન:૩</b>	મગફળીના પાકને ખાતર ક્યારે અને કેટલું આપવું જોઈએ ?
<b>જવાબ</b>	ચોમાસુ મગફળીના પાકને ૧૨.૫ કિલો નાઈટ્રોજન અને ૨૫ કિલો ફોસ્ફરસ તત્વ પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ છે આ માટે હેક્ટર દીઠ ૫૪ કિલો ડીએપી. અને ૬ કિલો યુરિયા ખાતરની જરૂર પડશે અથવા ડીએપી ને બદલે સીગલ સુપર ફોસ્ફેટ ખાતર ૧૫૬ કિલો ગ્રામ અને એમોનિયમ સલ્ફેટ દ્રોપ્સ ૨૨.૫ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ છે.
	સંશોધનના પરિણામો ઉપરથી ભલામણ કરવામાં આવેલ છે કે જો ફક્ત ચોમાસુ વરસાદ આધારીત ખેતી કરવામાં આવતી હોય અને દર વર્ષ મગફળીનો પાક લેવામાં આવતો હોયતો દર વરસે ૧૦ ટન છાણીયું ગણતિયું ખાતર આપવું અને દર ત્રીજા વરસે ૨૦ કિલો ફોસ્ફરસ તત્વ પ્રતિ હેક્ટર આપવાની ભલામણ છે.
<b>પ્રશ્ન:૪</b>	મગફળી પીળી પડી જવાના કારણો અને ઉપાય.
<b>જવાબ</b>	મગફળી ખાસ કરીને જાયરે ઉપરના પાન પીળા પડી જાય અને તેની નસો લીલી દેખાય તો લોહ તત્વની ઉણાપ ને લીધે આવું બનવા પામે છે. આના નિયંત્રણ માટે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી) અને ૧૦ ગ્રામ સાયટ્રીક એસીડ (લીબુના ફુલ) ને ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છંટકાવ ૧૦ દિવસે ફરીથી કરવો. ઉપરાંત જમીનમાં પાણી ભરાતું હોય તો તેને દુર કરવું.
<b>પ્રશ્ન:૫</b>	મગફળીના પાકમાં આતરખોડ અને નિંદામણ ક્યારે અને કેટલા કરવા.
<b>જવાબ</b>	મગફળીના પાકને પ્રથમ દોડ મહિનો નિંદામણ મુક્ત રાખવો ખાસ જરૂરી છે. આ માટે વાવણી પછી ૨૦ થી ૨૫ દિવસે પ્રથમ આંતર ખેડ તથા હાથથી નિંદામણ કરવું. ત્યાર બાદ જરૂર મુજબ બીજી બે થી ત્રીજા આંતર ખેડ અને હાથથી નિંદામણ કરવા જોઈએ મગફળીના સૂચા બેસી ગાયા પછીથી આંતર ખેડ કે નિંદામણ કરવાની જરૂર ઉભી થાયતો સૂચા ઉપરી ન જાય તે રીતે કાળજી રાખી નિંદામણ કરવું જોઈએ. અથવા જ્યાં મજૂરોની અછત હોય ત્યાં નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવો આ માટે મગફળી વાવ્યા બાદ બીજું સુરણ થયા પહેલા ૧ કિલોગ્રામ નિંદામણ નાશક દવા પેન્ડીમીથાલીન ૫૦૦ લીટર પાણીમાં ઓગાળી

		જમીન પર છંટકાવ કરવો. તથા મગફળી 20 દિવસની થાય ત્યારે કવીઝાલોઝોપ ઈથાઈલ દવા 0.04 કિ.ગ્રા. સકીય તત્વનો છંટકાવ કરવો અથવા મગફળી ઉગયા પહેલા પેનીમીથાલીન 1 કિલો ગ્રામ સકીય તત્વ તથા મગફળી 20 દિવસની થાય ત્યારે ઈમીજેથાફાયર 0.074 કિ.ગ્રા. સકીય તત્વ રૂપે છંટકાવ કરવો તયાર બાદ એક મહિના પછી એકવાર આંતર ખેડ અને હાથથી નિંદણનું નિયંત્રણ કરવું.
પ્રશ્ન: ૬	જવાબ	ચોમાસામાં વરસાદ ખેંચાય તો પૂરક પિયત કેટલા અને કયારે આપવા ?
પ્રશ્ન: ૭	જવાબ	ચોમાસા દરમ્યાન વરસાદ પૂરતો અને સપ્રમાણ થયેલ હોયતો મગફળીના પાકને વધારાના પિયત આપવાની જરૂરત રહેતી નથી પરંતુ જો કૂલ આવવા, સૂયા બેસવા, ડોડવા બંધાવા અને ડોડવાના વિકાસની અવસ્થાએ વરસાદ ખેંચાય અને ભેજની અછત જણાયતો વધારાનું (પૂરક) પિયત આપવાથી સારુ ઉત્પાદન મેળવી શકાય.
પ્રશ્ન: ૮	જવાબ	મગફળીના પાકમાં કયા કયા આંતર પાક લઈ શકાય ?
પ્રશ્ન: ૯	જવાબ	મગફળીએ સુકી ખેતીનો અને તે પણ અનિયમિત વરસાદ વાળા વાતાવરણનો પાક છે. તેથી એકલો પાક લેવા કરતા આંતર પાક લેવાથી જોખમ ઘટાડી શકાય છે અને સરવાળે બંને પાકમાંથી મળતી કુલ આવક સારી મેળવી શકાય. આ માટે મગફળીનાં પાક સાથે દિવેલા અથવા તુવેરને આંતર પાક તરીકે લઈ શકાય છે. આ માટે એક ઉભડી મગફળીની ત્રણ હાર સાથે એક હાર તુવેર અથવા દિવેલા (૩:૧) અથવા (૨) અર્ધ વેલડી મગફળીની બે હાર સાથે એક હાર તુવેર અથવા દિવેલા (૨:૧) પ્રમાણે વાવતેર કરી શકાય છે.
પ્રશ્ન: ૧૦	જવાબ	મગફળીના પાકમાં આવતી મોલો-મશી, લીલી પોપટી તેમજ શ્રીપ્સ રસ ચુસીને પાકને નુકશાન કરે છે. તો તેના નિયંત્રણની માહિતી આપો
પ્રશ્ન: ૧૧	જવાબ	મગફળીના પાકમાં આવતી મોલો-મશી, લીલી પોપટી તેમજ શ્રીપ્સના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૦.૦૩ ટકા (૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. દવા) અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૦.૦૨૫ (૧૦ લિ. પાણીમાં ૧૦ મીલી દવા) અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ % (૧૦ લિ. પાણીમાં ૩ મીલી દવા) ના પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો અને જરૂર જણાય તો ૧૦ થી ૧૨ દિવસ બાદ બીજો છંટકાવ કરવો.
પ્રશ્ન: ૧૨	જવાબ	મગફળીના પાકમાં લશકરી તેમજ લીલી ઈયણના નિયંત્રણ અંગે માર્ગદર્શન આપો.
પ્રશ્ન: ૧૩	જવાબ	આ જીવાતના નિયંત્રણ માટે કલોરપાયરીઝોસ ૦.૦૫ ટકા (૧૦ લિટર પાણીમાં ૨૫ મિ.લિ. દવા) અથવા મીથોમાઈલ ૦.૦૫ ટકા (૧૦ લિટર પાણીમાં ૧૨.૫ ગ્રામ દવા) અથવા મોનોકોટોઝોસ (૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. દવાના) પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો. જરૂર જણાયતો ૧૦ થી ૧૨ દિવસ પછી કોઈપણ એક દવાનો બીજો છંટકાવ કરવો. તદઉપરાંત એન. પી.વી. દ્વારા રોગિષ થયેલ ૨૫૦ ઈયણોનું શુદ્ધ દ્રાવણ પ્રતિ હેક્ટર ૬૫ દર પાંચ દિવસે ચાર વખત છંટકાવ કરવાથી ઉપદ્રવ નિયંત્રણમાં રહેશે.
પ્રશ્ન: ૧૪	જવાબ	મગફળીના પાકમાં સફેદ ધૈણના નિયંત્રણ માટેના ઉપાયો જણાવો ?
પ્રશ્ન: ૧૫	જવાબ	મગફળીના પાકમાં જે વિસ્તારમાં ગોરણું અને રેતાળ જમીન હોય અને મગફળીના પાકનું વાવતેર કરવામાં આવે તો આ સફેદ ધૈણનો ઉપદ્રવ જોવા મળે છે. આ જીવાતની કેટલીક ખાસિયતોને લીધે તેનું નિયંત્રણ કરવાનું ખૂબ જ મુશ્કેલ છે. પરિણામે તેના જીવાતની દરેક અવસ્થાએ તેમની વસ્તી ઘટાડી શકાય તેવો સામુહિક ઉપાયોનું સંકલિત આયોજન કરી નિયંત્રણના ઉપાયો કરવા જોઈએ. આ જીવાતના નિયંત્રણ માટે સૌ પ્રથમ પહેલો સારો વરસાદ થયા પછી સંધ્યા સમયે જમીનમાંથી નીકળીને ખેતરના શેઢા-પાળા પર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે જાડના પાન ખાવા આવતા ઢાલિયાને જાડના ડાળા હલાવી નીચે પાડી વીણાવી લઈ કેરોસીનવાળા પાણીમાં નાશ કરવો. આ ઉપરાંત ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે જાડ ઉપર બધા પાન પર સારી રીતે છંટાય તે પ્રમાણે કાર્બરીલ ૦.૨ ટકા (૧૦ લિટર પાણીમાં ૪૦ ગ્રામ દવા) પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો. ઉનાળામાં ત્રણ ઉડી ખેડ કરવાથી પણ સફેદ ધૈણનો ઉપદ્રવ ઓછો થાય છે. ધૈણના ઢાલિયા કીટકો રાત્રીના સમયે પ્રકાશ તરફ આકર્ષણીતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષણીતા પુખ્ખ ઢાલિયા કીટકોનો નાશ કરવો જોઈએ. સામુહિક ઉપાયોની સાથે સાથે વ્યક્તિગત ઘોરણે પણ પોતાનો પાક બચાવવા દરેક ખેડુંતે પાક વાવતા પહેલા ચાસમાં લિન્ડેન ૦.૬૫ ટકા ભૂકી દવા હેક્ટરે ૧૨૫ કિ.ગ્રા. પ્રમાણે ૧૦ સે..મી. ઉડાઈએ આપવી જોઈએ અથવા કલોરપાયરીઝોસ ૨૦ ટકા ઈ.સી. અથવા કવીનાલફોસ ૨૫ ઈ.સી. દર કિ.ગ્રા. બીજ દીઠ ૨૫ મિ.લિ. પ્રમાણેની બીજ માવજત વાવતા પહેલા ત્રણ કલાકે આપી છાંયડામાં સૂકવી પછી બીજનો વાવેતર તરીકે ઉપયોગ કરવો. સફેદ ધૈણના નિયંત્રણ માટે અગાઉથી કોઈપણ જંતુનાશક દવાના ઉપાયો ન લીધા હોય અને તેમનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે તો ઉભા પાકમાં કવીનાલફોસ ૨૫ ઈ.સી. અથવા કલોરપાયરીઝોસ ૨૦ ઈ.સી. હેક્ટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આપવી.

<b>પ્રશ્ન: ૧૧</b>	<b>મગફળીમાં આવતા ભોટવા જીવાતનું કઈ રીતે નિયંત્રણ કરી શકાય ?</b>
જવાબ	<p>૧. મગફળીનો સંગ્રહ કરતા પહેલા તેને સૂર્યના તાપમાં સુકવી અને ડોડવામાં ૮ % કરતા ઓછો ભેજ હોય ત્યારે સંગ્રહ કરવો.</p> <p>૨. કોઠાર (સ્ટોર) માં ભરવા પહેલા તેની દિવાલો, છત અને ભોય તળીયા ઉપર ડાયકલોરોવોશ ૦.૫ % અથવા મેલાથીઓન ૧.૨૫ % અથવા ફેનીટ્રીથ્યોન ૨ % અથવા ડેલટામેશ્નીન ૦.૦૪ % વાળુ ૫ લીટર પ્રવાહી દ્રાવણ પ્રતિ ૧૦૦ મીટર દીઠ છાંટવુ.</p> <p>૩. મગફળી ભરેલી ગુણીઓને કોઠાર (સ્ટોર) ની દિવેલાથી દુર રહેતે રીતે લાકડાના પાટીયા ઉપર થખી ગોઠવીને સંગ્રહ કરવો.</p> <p>૪. ઉપદ્રવીત મગફળીમાં ધૂમિકરણ કરવાની જરૂર પડે તો એલ્યુમીનીયમ ફોરફાઈડ દવાની દર ટન દીઠ ૨ થી ૫ ટીકીઓ પુરતી છે. ધૂમિકરણ માટે દવા મુક્યા પછી તેના ઉપર ઢાકેલ કરવને સાત દિવસ સુધી ખોલવું નહીં. ધૂમીકરણની માવજત આપયા બાદ સાત દિવસ પછી હવાની અવર જવર થાય તે માટે કવરને ખોલી નાખવું જોઈએ.</p>
<b>પ્રશ્ન: ૧૨</b>	<b>મગફળીનો ઉગસુકનો રોગ ક્યારે આવે અને તેનું નિયંત્રણ કઈ રીતે થઈ શકે ?</b>
જવાબ	આ મગફળીનો રોગ વાવેતર પછીના એક મહિનાની અંદર આવે છે. જેના અસરકારક નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા કોઈપણ એક કુગનાશક દવા જેવીકે મેન્કોઝેબ, કેપટાન કે થાયરમ ત ગ્રામ દવા / એક કિલો પર બીજને આપીને વાવવો, તેમજ સારી ગુણવાતા વાળા અને નુકશાની વગરના બીજ જ વાવવા.
<b>પ્રશ્ન: ૧૩</b>	<b>મગફળીમાં આવતા સફેદ કુગના અથવા થડના કોહવારાના રોગના નિયંત્રણ માટે ક્યાં ક્યાં અગત્યના પગલા લેવા જરૂરી છે ?</b>
જવાબ	ઉનાળામાં જમીનમાં ચવડાથી ઉરી ખેડ કરવી. બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રામ બીજ દીઠ ત થી ૪ ગ્રામ મેન્કોઝેબ અથવા થાયરમ અથવા કેપટાન નો બરાબર પટ આપીને વાવવા સંપૂર્ણ સરી ગયેલ સેન્ટ્રિય ખાતરો જ વાવવા તેમજ વાવતી વખતે ટ્રાઇકોડર્માં કુગ આધારીત પાઉડર ૨.૫ કિ. ની સાથે ૩૦૦ કિ. એરંડાનો ખોળ અથવા છાણિયું ખાતર મીક્ષ કરી એક હેક્ટરમાં ચાસમાં આપવું. મગફળીના વાવેતર બાદ સમાર મારવો, ઉભા પાકમાં પાળા ચડાવવા નહિં. તેમજ પાકમાના રોગિષ્ટ છોડનો નાશ કરવો.
<b>પ્રશ્ન: ૧૪</b>	<b>પાનના ટપકાના તેમજ ગેરુનાં રોગોના નિયંત્રણ માટે શું ખ્યાલ રાખવો જરૂરી છે.</b>
જવાબ	મગફળીમાં ટપકાના રોગ ઓછા આવે તે માટે આગલા વરસની મગફળીના અવશેષો વીણી બાળી નાંખવા. પાનના વહેલા – મોડા ટપકાના રોગ તેમજ ગેરુના રોગો માટેના સંયુક્ત નિયંત્રણ માટે મગફળી ત૦ થી ત૫ દિવસની થાય ત્યારે પ્રથમ છંટકાવ મેન્કોઝેબનો (૦.૨% પ્રમાણો એટલે કે ૧૦ લીટર પાણીમાં ૨૫ ગ્રામ) મુજબ, બીજો છંટકાવ કાબેન્ડાઝીમનો (૦.૦૨૫% પ્રમાણો એટલે કે ૧૦ લીટર પાણીમાં ૫ ગ્રામ મુજબ) તેમજ ત્રીજો છંટકાવ મેન્કોઝેબનો ૦.૨% મુજબ (૧૫-૧૫ દિવસના અંતરે) કરવા જરૂરી છે. પાનના ટપકાના અસરકારક નિયંત્રણ માટે માત્ર એક દવા કલોરોથાલોનીલ (૧૦ લીટર પાણીમાં ૨૫ ગ્રામ) અથવા હેક્ઝકોનોઝેલ (૧૦ લીટર પાણીમાં ૫ મી.લી.) કુગનાશક દવાના ત્રણ છંટકાવ રોગ આવવાની શરૂઆત થાય ત્યાર થી ૧૫ દિવસના અંતરે કરવાથી રોગનું નિયંત્રણ કરી શકાય છે.
<b>પ્રશ્ન: ૧૫</b>	<b>નિકાસલક્ષી મગફળીમાં આફલાટોકસીનનું પ્રમાણ ઘટાડવા શા ઉપાયો કરવા જોઈએ?</b>
જવાબ	<ul style="list-style-type: none"> <li>● શક્ય હોય તો પાકની પાછલી અવસ્થાએ હુઝાળની પરિસ્થિતિમાં પિયત આપવું. કારણ કે, પાણીની ખેંચના કારણે આ પ્રકારની સમસ્યા વધે છે.</li> <li>● નિંદામશ અને મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઈજા થતી અટકાવો. મગફળી બરાબર પાકે પછી જ ઉપાડો, વધારે પડતી પાકેલ મગફળીમાં આ સમસ્યાની શક્યતા વધારે રહેલી છે.</li> <li>● મગફળીના જથ્થામાંથી કુગ લાગેલ તથા નુકશાન પામેલ ડોડવા દુર કરો.</li> <li>● રોગીષ્ટ છોડની તથા જમીનની મગફળી સારી તંદુરસ્ત મગફળી સાથે ભણતી અટકાવો.</li> <li>● જમીનજન્ય રોગ અને જીવાતનું નિયંત્રણ કરો.</li> <li>● શક્ય હોયતો મગફળી ઉપાડતી વખતે વરસાદ ન નડે તે રીતે વાવેતરનો સમય નક્કી કરો.</li> <li>● ડોડવાને ૮ ટકાથી ઓછો ભેજ રહે તેમ ઝડપથી સુકવી સંગ્રહ કરો.</li> <li>● સુકી અને ભેજ વગરની જગ્યામાં કોઠારની જીવાત તથા કુગની વૃદ્ધિ અટકાવી સંગ્રહ કરો.</li> <li>● એક દાણાવાળા, ચિમળાયેલા અને જાંખા પડી ગયેલા દાણાવાળા ડોડવા દુર કરો.</li> </ul>

પ્રશ્ન: ૧૬	મગફળીફળી કાપણી અને સંગ્રહ સમયે શું કાળજી રાખવી જોઈએ?																				
જવાબ	જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે પરિપક્વ મગફળીની ઉભડી જાતો હાથથી ઉપાડવી જ્યારે વેલડી, અર્દ્ધ વેલડીને કરબ મારી છોડ ભેગા કરી લઈ નાના નાના પાથરા (ઢગલા) માં એક અઠવાડિયુ સુકવવા. આ દરમ્યાન પાથરા એક વખત ફેરવી નાખવા. ડોડવામાં એ ટકાથી વધુ ભેજ ન રહે ત્યારે શેસરમાં નાખી છુટા પાડી પ્રાથમિક સફાઈ જેવીકે કચરો, માટી, ડાખરા વગેરેથી સાફ કરી લઈ છેલ્લે પવનથી ઘાર આપી ચોખ્ખા કરી લેવા. કંતાનના કોથળામાં યોગ્ય માપની ભરતી કરી સૂકા—સ્વચ્છ સ્ટોરમાં સંગ્રહ કરવો.																				
પ્રશ્ન: ૧૭	નિકાસલક્ષી મગફળીની જાતો કઈ છે?																				
જવાબ	મગફળીની નિકાસ માટે ૩૦ થી ૫૦ કાઉન્ટના દાણાવાળી જાતો ઉપયોગી છે. આ માટે જીજી-૨, જીજી-૭, જીજેજી-૮, જીજી-૨૦, જીજેજી-૧૭, જીજેજી-૨૨ વગેરે મગફળીની જાતોનો ઉપયોગ કરી શકાય છે. નિકાસલક્ષી મગફળીના દાણામાં આફલાટોકસીનનું પ્રમાણ મર્યાદામાં હોવુ જરૂરી છે.																				
પ્રશ્ન: ૧૮	પિયત અને બિન પિયત વિસ્તારમાં દિવેલાની કઈ કઈ જાતો પસંદ કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય?																				
જવાબ	બિનપિયત વિસ્તાર માટે દિવેલાની જી.એ.યુ.સી.એચ.—૧ જાતની ભલામણ કરવામાં આવે છે. આ ઉપરાંત જી.સી.એચ.—૪ સંકર જાત પણ વાવવી શકાય. જ્યારે પિયત વિસ્તાર માટે જી.સી.એચ.—૪, જી.સી.એચ.—૫, જી.સી.એચ.—૬ અને જી.સી.એચ.—૭ ની ભલામણ છે. જો દિવેલાનું વાવેતર મોડુ કરવુ હોય તો દિવેલાની જી.સી.એચ.—૫ જાત પસંદ કરવી. જે વિસ્તારમાં મૂળના કોહવારનો રોગ લાગુ પડતો હોય તેવા વિસ્તારમાં જી.સી.એચ.—૨ કે જી.સી.એચ.—૬ જાત વાવવી જેથી ઉત્પાદન સારુ મળે છે.																				
પ્રશ્ન: ૧૯	દિવેલાના પાકમાં પાયાનું ખાતર અને પૂર્તિ ખાતર વિષે વિગતવાર માહિતી જણાવો?																				
જવાબ	દિવેલા લાંબા ગાળાનો પાક હોઈ વધુ ઉત્પાદન લેવા માટે હેક્ટર દીઠ ૨૦ થી ૨૫ ગાડી છાણિયું ખાતર આપવાની ભલામણ છે. પ્રાથમિક ખેડ પહેલા છાણિયું ખાતર જમીનમાં નાખીને એક હળની અને બે થી ત્રણ કરબની ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરવી. દિવેલા પાકને નાઈટ્રોજન તત્વની જરૂરિયાત વધુ રહે છે. પિયત અને બિન પિયત પરિસ્થિતિમાં ખાતરની જરૂરીયાત જુદી-જુદી રહે છે. બિન પિયત દિવેલાનું અર્થક્ષમ રીતે વધુ ઉત્પાદન મેળવવા માટે ૪૦ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૩૦ કિલોગ્રામ ફોસ્ફરસનો તમામ જથ્થો વાવણી વખતે પાયાના ખાતર તરીકે આપવો. તેમ છતાં નાઈટ્રોજન ખાતરને બે સરખા હપામાં વહેચી પહેલો હપ્તો વાવણી વખતે પાયાના ખાતર તરીકે અને બીજો હપ્તો વાવણી પછી પાક ત૦-૨૫ દિવસનો થાય અને જમીનમાં ભેજ હોય ત્યારે પૂર્તિ ખાતર તરીકે આપવો.																				
	પિયત દિવેલામાં હેક્ટર દીઠ ૭૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ આપવાની ભલામણ છે. તેમાનો ૩૭.૫ કિલો નાઈટ્રોજન ૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ વાવેતર વખતે જમીનમાં આપવો. તેમજ ૧૮.૭૫ કિલો નાઈટ્રોજન વાવણી બાદ ૪૦ દિવસે અને ફરીથી તેટલો જ જથ્થો વાવણી બાદ ૭૦ દિવસે આપવો.																				
	જમીનમાં જો સલ્ફર તત્વની ઉણપ હોય તો હેક્ટરે ૨૦ કિ.ગ્રા. સલ્ફર (૧૨૫ કિ.ગ્રા. જીપ્સમના રૂપમાં) આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.																				
	દિવેલા પાકમાં હેક્ટર દીઠ વધુ આર્થિક વળતર મેળવવા માટે હેક્ટરે ૧૨૦-૫૦-૦૦ નાઈટ્રોજન તથા ફોસ્ફરસ (કિ.ગ્રા.) આપવાની ભલામણ છે. એટલેકે																				
	<table border="0"> <thead> <tr> <th>ક્રમ ના.</th> <th>ભલામણ કરેલ તત્વ</th> <th>રાસાયણિક ખાતરનું પ્રમાણ (કિ.ગ્રા./હે.)</th> <th>સમય</th> </tr> </thead> <tbody> <tr> <td>૧</td> <td>૪૦-૫૦-૦૦</td> <td>૧૦૮ ડીએપી, ૪૩ વાવતી વખતે યુરિયા</td> <td>૧૦૮ દિવસ</td> </tr> <tr> <td>૨</td> <td>૩૦-૦૦-૦૦</td> <td>૬૩ યુરિયા</td> <td>૪૦ દિવસ</td> </tr> <tr> <td>૩</td> <td>૩૦-૦૦-૦૦</td> <td>૬૩ યુરિયા</td> <td>૭૦ દિવસ</td> </tr> <tr> <td>૪</td> <td>૨૦-૦૦-૦૦</td> <td>૪૨ યુરિયા</td> <td>૧૦૦ દિવસ</td> </tr> </tbody> </table>	ક્રમ ના.	ભલામણ કરેલ તત્વ	રાસાયણિક ખાતરનું પ્રમાણ (કિ.ગ્રા./હે.)	સમય	૧	૪૦-૫૦-૦૦	૧૦૮ ડીએપી, ૪૩ વાવતી વખતે યુરિયા	૧૦૮ દિવસ	૨	૩૦-૦૦-૦૦	૬૩ યુરિયા	૪૦ દિવસ	૩	૩૦-૦૦-૦૦	૬૩ યુરિયા	૭૦ દિવસ	૪	૨૦-૦૦-૦૦	૪૨ યુરિયા	૧૦૦ દિવસ
ક્રમ ના.	ભલામણ કરેલ તત્વ	રાસાયણિક ખાતરનું પ્રમાણ (કિ.ગ્રા./હે.)	સમય																		
૧	૪૦-૫૦-૦૦	૧૦૮ ડીએપી, ૪૩ વાવતી વખતે યુરિયા	૧૦૮ દિવસ																		
૨	૩૦-૦૦-૦૦	૬૩ યુરિયા	૪૦ દિવસ																		
૩	૩૦-૦૦-૦૦	૬૩ યુરિયા	૭૦ દિવસ																		
૪	૨૦-૦૦-૦૦	૪૨ યુરિયા	૧૦૦ દિવસ																		

**પ્રશ્ન : ૨૦ દિવેલાનાં પાકમાં છોડ સુકાય જવાના કારણો અને તેના ઉપયો જણાવો ?**

**જવાબ** આપણા રાજ્યમાં દિવેલાનાં પાકમાં ફ્યુઝેરીયમ પ્રકારની કુગથી થતો છોડનો સુકારો અને મેકોફોભીના પ્રકારની કુગથી થતો મુણનો કોહવારો જેવા રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. સામાન્ય રીતે બિનપિયત પાકમાં અને પિયત પાકમાં પણ ચોમાસાનો વરસાદ ખેંચાય ત્યારે પિયત ન આપી શકાય તો મેકોફોભીનાથી થતો મુણનો કોહવારો વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે નીચે પ્રમાણેના પગલા લેવા.

૧. બીજને થાયરમ ઉ થામ અથવા બાવીસ્ટીન ૧ થામ પ્રતિ કિલો બીજ દીઠ કુગનાશક દવાનો પટ આપ્યા પછી વાવણી કરવી.
૨. ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી પાકની ફેરબદલી કરવી.
૩. રોગ સામે સહનશક્તિ ધરાવતી જીસીએચ-૨ અને જીસીએચ-૬ સંકરજાતોનું વાવેતર કરવું.
૪. ઓકટોબરમાં વધુ ગરમી પડતી હોય ત્યારે વરસાદ ન હોય તો શક્ય હોય તો પિયત આપી દેવું.
૫. રોગવાળા છોડને મૂળ સાથે ઉપાડી લઈ નાશ કરવો.
૬. ઉનાળામાં ઉડી ખેડ કરી ખેતર તપવા દેવું.

છોડના સુકારાનાં નિયંત્રણ માટે નીચે પ્રમાણેના પગલા લેવા :

૧. ઉપર જણાવ્યા મુજબ બીજને કુગનાશક દવાનો પટ અને પાકની ફેરબદલી કરવી.
૨. રોગપ્રતિકારક સંકર જાત, જીસીએચ-૪, જીસીએચ-૫ અને જીસીએચ-૭ નું વાવેતર કરવું.
૩. રોગવાળા છોડને મૂળ સાથે ઉપાડી લઈ નાશ કરવું.
૪. પાણી ભરાઈ રહેતું હોય તેવા ખેતરમાં દિવેલાનું વાવેતર ન કરવું.
૫. પાકની ફેરબદલી કરવી અને ઉનાળામાં ઉડી ખેડ કરવી.

**પ્રશ્ન : ૨૧ દિવેલાના પાકમાં ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં ઘોડિયા ઈયળને કારણો ખુબજ નુકશાન થાય છે તો તેના નિયંત્રણ ઉપાયો જણાવો ?**

**જવાબ** નાની ઈયળો પાનમાં અનિયમિત આકારના કાણા પાડે છે. મોટી ઈયળો પાનની ધારેથી ખાઈ નસો છોડિને છોડને જાંખરા જેવો બનાવી દે છે. તેથી તેના નિયંત્રણ માટે કવીનાલફોસ ૨૦ મિ.લી. અથવા ડી.ડી.વી.પી. ૫ મિ.લી. અથવા કાર્બોરીલ ૪૦ થામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ હોય તો કવીનાલફોસ ૧.૫ ટકા ભૂકી અથવા મિથાઈલ પેરાથીયોન ૨ ટકા ભૂકી દવા હેક્ટરે ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છાંટવી.

**પ્રશ્ન : ૨૨ ચોમાસા માટે તલની કઈ જાતનું વાવેતર કરી શકાય.**

**જવાબ** ચોમાસામાં તલનું વાવેતર કરવા માટે ગુજરાત તલ-૧, ગુજરાત તલ-૨, ગુજરાત તલ-૩, ગુજરાત તલ-૪ અને કાળા તલ માટે ગુજરાત તલ-૧૦ નું વાવેતર કરવા ભલામણ છે.

**પ્રશ્ન : ૨૩ ઉનાળામાં તલની કઈ જાત વાવવા માટે પસંદ કરવી?**

**જવાબ** ગુજરાત તલ-૨ અને ગુજરાત તલ-૩ નું વાવેતર કરી શકાય ગુજરાત તલ-૨ જાત ઉનાળા માટે વધારે અનુકૂળ આવે છે.

**પ્રશ્ન : ૨૪ ઉનાળુ તલનું વાવેતર કયારે કરવું?**

**જવાબ** ઉનાળુ તલનું વાવેતર ૧૫ મી ફેલ્લુઆરીએ કરવાથી ઉત્પાદન સારુ મળે છે. વહેલુ વાવેતર કરવાથી ઠંડીને લીધે સારો ઉગાવો મળેતો નથી તેમજ મોડુ વાવેતર કરવાથી કાપણી વખતે વરસાદ આવી જવાથી નુકશાન થવાનો ભય રહેછે.

**પ્રશ્ન : ૨૫ ઉનાળુ તલમાં પિયત કેટલા આપવા તેમજ શુ કાળજી રાખવી.**

**જવાબ** ઉનાળુ તલમાં જમીનની જાત અને હવામાન આધારીત ૮ થી ૧૦ પિયતની જરૂર પડે છે. પ્રથમ ઓરવણાનું પિયત, બીજુ વાવણીબાદ ચાર દિવસે સારા ઉગાવ માટે આછુ પિયત આપવું. ઉગાવો થઈ ગયા બાદ પિયત આપવામાં છોડ દુબી ન જાય તે ખાસ કાળજી રાખવી. ત્યાર બાદના પિયત જરૂરીયાત મુજબ ૮ થી ૧૦ દિવસના ગાળે આપવા. કુલ આવવા, બૈઠા બેસવા તથા દાણાના વિકાસ સમયે પિયતની ખેંચ ન જણાય તે રીતે પિયત આપવા.